



Hindustan Oil Exploration Company Limited

'Lakshmi Chambers', 192, St. Mary's Road, Alwarpet, Chennai - 600 018. INDIA.

☎ : 91 (044) 66229000 • Fax: 91 (044) 66229011 / 66229012

E-mail: contact@hoec.com • Website: www.hoec.com CIN: L11100GJ1996PLC029880

August 15, 2025

By Online

The Listing Department National Stock Exchange of India Ltd., "Exchange Plaza", Bandra Kurla Complex, Bandra (East), Mumbai – 400 051 Stock Code: HINDOILEXP	The Corporate Relationship Department BSE Limited 1 st Floor, P. Jeejeebhoy Towers, Dalal Street, Mumbai – 400 001 Stock Code: 500186
--	--

Dear Sir/Madam,

Sub: Submission of the copy of Newspaper Advertisement towards publication of financial results for the quarter ended June 30, 2025

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find attached the copy of Newspaper Advertisements published in Business Line (All editions), Business Standard (Ahmedabad Edition) and Loksatta (Vadodara Edition) pertaining to the unaudited financial results for the quarter ended June 30, 2025.

The above information is also available on the website of the Company - www.hoec.com.

We request you to kindly take our above submission on record.

Thanking you,

Yours Sincerely,

For Hindustan Oil Exploration Company Limited

G. Josephin Daisy

Company Secretary

Encl.: a/a

XED Executive becomes first firm to file for IPO at Gift IFSC, targets \$12 million

Avinash Nair
Ahmedabad

The process of direct listing of equities has begun in Gift IFSC, with Mumbai-based ‘global executive education’ provider XED Executive Development Ltd filing the first Draft Red Herring Prospectus (DRHP) with both NSE-IX and India INX — the two international stock exchanges operating out of Gift City in Gujarat.

“The company is targeting an IPO size of \$12 million,” Founder John Kalleilil told *businessline*. The offer is by way of a fresh issue of \$9.6 million and an offer-for-sale of \$2.4 million by the promoter selling shareholder. Of the total net IPO proceeds, \$1.8 million is proposed to be used as technology capex, \$2.4 million as working capital, \$1.2 million as IPO cost and \$4.4 million for general corporate purpose and ‘unidentified acquisition’.”

A NEW CHAPTER

In FY25, XED Executive Development Ltd’s revenue from operations stood at \$4.59 million, up 15 per cent over the previous year. During the year, 54 per cent of the company’s revenues came from



EXECUTIVE TRAINING. XED Executive Development Ltd offers executive education programmes targeting senior working professionals

Singapore, 41 per cent from India, 3.4 per cent from Saudi Arabia and 2 per cent from the US. Revenue from operations is driven by a mix of public programmes (B2C) and custom programmes (B2C). Public programme revenue is generated through direct enrolments in executive

education offerings, typically priced between \$4,500 and \$28,000. Revenue from custom programmes is earned from institutional clients through negotiated fees tailored to the learning objectives.

A significant portion of the revenue of the company is derived from programmes offered in collaboration with Cornell University. Government of Maharashtra, JSW, Bank of America and Kotak Mahindra Bank Ltd are among its top 10 B2B customers.

The company designs and delivers programmes across multiple delivery formats, including in-person sessions, live online and hybrid models.

WHO CAN PARTICIPATE?

A person who is not a resident of India can only invest, trade, or hold equity shares of Indian companies listed on international exchanges. As of now, the IFSCA framework allows unlisted public Indian companies to list their shares on an international exchange.

Bitcoin hits record \$124,000 as global trading volumes soar

Sanjana B
Bengaluru



Bitcoin touched a record high of \$124,000 on Thursday, on expectations of an interest rate cut in September, steady ETF inflows, corporate buying and strong derivatives activity.

Global Bitcoin trading volumes soared from \$16.53 billion in February to \$90.9 billion on August 14, while its market capitalisation climbed to \$2.45 trillion from \$1.9 trillion six months ago, according to CoinMarketCap.

CoinDCX reported that monthly trading volumes rose to \$577 million in July from \$483 million in February.

highs. Derivative open interest consistently exceeded \$20 billion, underscoring institutional positioning. Notably, stablecoin inflows have correlated with volume spikes, reflecting capital rotation into crypto risk. Volume surges during key macro events revealed heightened sensitivity to global risk sentiment,” he said.

KEY DRIVER

Himanshu Maradiya, Founder and Chairman of CIFDAQ, said that institutional inflows remain a key driver of BTC ETFs adding over \$3.6 billion in the past month, while corporate and sovereign treasuries now hold 3.64 million BTC, or 17 per cent of the supply.

The market sentiment was lifted also by the Donald Trump administration’s decision to relax investment rules for crypto assets, with some analysts predicting that Bitcoin could approach \$140,000 in the coming weeks if the current momentum holds.

LEADING CHARTS

Its monthly transparency report showed Bitcoin leading the charts at \$40.2 million in July, double the \$19.3 million recorded in February.

Over the past six months, Bitcoin trading volumes have painted a picture of deepening market maturity, Parth Srivastava, Head of Quant, 9Point Capital’s Research Team, noted.

“We’ve seen sustained liquidity expansion on both spot and derivatives markets, with monthly averages holding near multi-year

G-Secs rally on S&P’s rating upgrade for India

K Ram Kumar
Mumbai

The Government Securities (G-Secs) market rallied on Thursday on expectations of foreign portfolio investor (FPI) flows into the debt market, after S&P Global upgraded India’s sovereign rating from ‘BBB-’ to ‘BBB’, with a stable outlook.

The 10-year benchmark G-Sec (6.33 per cent GS 2035) rallied about 50 paise, with its yield dipping eight basis points (bps) to close at 6.40 per cent from the previous close of 6.48 per cent.

S&P Global noted that India is prioritising fiscal consolidation, demonstrating the government’s political commitment to deliver sustainable public finances. Further, robust economic expansion is having a constructive effect on India’s credit metrics, and the agency expects sound economic fundamentals to underpin growth momentum over the next two to three years.

SLOW AND STEADY...

Yield of the 10-year benchmark G-Sec had breached the 6.5 per cent mark on Wednesday for the first time after it was issued in May

2025. Marzban Irani, Chief Investment Officer – Fixed Income, LIF Mutual Fund, observed that yield of the benchmark paper could gradually move towards the 6.25 per cent level once volatility in the currency moderates and foreign investors start coming in due to the sovereign rating upgrade.

Further, the upgrade could also support inclusion of India’s sovereign debt in other global indices, going ahead. “Foreign investors will not immediately channelise funds into our debt market. This will happen over a period of time,” Irani said.

The LIC MF Fixed Income CIO expects a repo rate cut in the October bi-monthly monetary policy review.

Madhavi Arora, Chief Economist, Emkay Global Financial Services, said, “Despite possibly better FPI debt flows, demand from domestic agents stays unconvincing, especially at the longer end.”

“While we believe the rate easing cycle may still have further room to run, markets are not fully pricing the same, thus further aiding G-Sec curve steepness. The 10-year G-Sec yield may range at 6.35-6.50 per cent,” she added.

<div><div></div><div>HINDUSTAN OIL EXPLORATION COMPANY LIMITED Registered Office: 'HOEC House', Tandalja Road, Off Old Padra Road, Vadodra-390 020. Website: www.hoec.com Email: hoecshare@hoec.com CIN: L11100GJ1996PLC029880</div></div>									
Extract of Standalone and Consolidated Financial Results (Unaudited) for the Quarter ended June 30, 2025									
(₹ in Lacs except per share data)									
S. No.	Particulars	Standalone				Consolidated			
		For the Quarter ended		Year ended		For the Quarter ended		Year ended	
		30 June 2025	31 March 2025	30 June 2024	March 31 2025	30 June 2025	31 March 2025	30 June 2024	March 31 2025
		Unaudited	Unaudited	Unaudited	Audited	Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total Income from Operations	8,197.54	17,901.90	8,371.91	38,498.00	8,150.66	10,047.20	14,675.29	49,699.34
2	Net Profit for the period (before tax and exceptional items)	1,569.26	13,100.85	1,262.64	14,847.33	1,222.10	3,557.68	4,850.39	14,995.13
3	Net Profit for the period before tax (after exceptional items)	4,821.13	13,100.85	1,262.64	14,847.33	4,473.97	3,557.68	4,850.39	14,995.13
4	Net Profit for the period after tax (after Exceptional items)	4,821.13	13,000.81	1,218.28	14,747.29	4,387.35	5,115.93	4,191.91	14,720.77
5	Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	4,811.61	12,988.97	1,209.86	14,709.19	4,377.83	5,104.83	4,183.49	14,684.41
6	Equity Share Capital	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93
7	Reserves				1,02,712.67				1,18,900.11
8	Earnings Per Share (Face value of ₹ 10/-each) (not annualized)								
	Basic EPS ₹	₹ 3.65	₹ 9.83	₹ 0.92	₹ 11.15	₹ 3.32	₹ 3.87	₹ 3.17	₹ 11.13
	Diluted EPS ₹	₹ 3.65	₹ 9.83	₹ 0.92	₹ 11.15	₹ 3.32	₹ 3.87	₹ 3.17	₹ 11.13
The above is an extract of detailed format of Quarterly financial results filed with the Stock Exchanges under regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly financial results is available on the Stock Exchange websites www.bseindia.com, www.nseindia.com and Company's website www.hoec.com.									
									
					BY ORDER OF THE BOARD For Hindustan Oil Exploration Company Limited				
					R.Jeevanandam Managing Director DIN: 07046442				
Place : Chennai									
Date : August 14, 2025									



THE HINDU GROUP

FREEDOM SALE

UP TO 50% OFF

From August 09-24, 2025




Stack up your living room with specially-curated books from **The Hindu Group**



To avail this limited period offer, scan QR code or visit newsth.live/THBookStore


For bulk booking and enquiries, contact us at bookstore@thehindu.co.in or 1800 102 1878

*Offer only for Select Books | Shipping charges extra | Terms and Conditions apply



Government of Kerala
Published Tenders from 11-08-2025 to 13-08-2025
Department of Printing

Tender ID: 2025_DPR_784488_1 * Director of Printing * Re E tender for the supply of Light Duty Stitching Machine. * Closing Date: 23-Aug-2025 * PAC: Rs1100000
Visit <https://etenders.kerala.gov.in> for more details.
Ro.No:11-13/Aug/2025/PRD/N/9



VAMSHI RUBBER LIMITED
CIN: L25100TG1993PLC018634
Regd. Office: 'VAMSHI HOUSE', Plot No. 41, Jayabheri Enclave, Gachibowli, Hyderabad-500032, Telangana
E-Mail: info@vamshirubber.org, Website: www.vamshirubber.org

ISO 9001:2018 COMPANY

EXTRACT FROM THE UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE, 2025 (RS. IN LAKHS)

Sr. No.	PARTICULARS	QUARTER ENDED 30-06-2025 Unaudited (Ind AS)	QUARTER ENDED 30-06-2024 Unaudited (Ind AS)	Year Ended 31-03-2025 Audited (Ind AS)
1.	Total Income from operations	2,350.86	2,332.03	8,619.38
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	28.72	22.52	88.66
3.	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	28.72	22.52	85.24
4.	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	27.64	15.77	67.64
5.	Total Comprehensive Income for the period (comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (After tax)	31.88	15.77	84.60
6.	Equity Share Capital	420.68	420.68	420.68
7.	Reserves excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	1,064.73	964.02	1,032.85
8.	Earning Per Share (after extraordinary items) (of Rs.10/- each) (a) Basic (in Rs.) (b) Diluted (in Rs.)	0.76 0.76	0.37 0.37	2.01 2.01

NOTE:
1) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchanges websites, www.bseindia.com and website of the Company www.vamshirubber.org
2) The Company has adopted Indian Accounting Standards under Section 133 of the Companies Act, 2013 (Ind AS) from 1st April, 2017

By the Order of the Board
for Vamshi Rubber Limited
Sd/-
(M.RAMESH REDDY)
Chairman & CFO
DIN : 00025101

Place : Hyderabad
Date : 14-08-2025



BLACKBUCK
ZINKA LOGISTICS SOLUTIONS LIMITED
(Formerly Known as Zinka Logistics Solutions Private Limited)
Corporate Identification Number: L3300KA2015PLC079884
Registered Office: Vaswani Presidio No. 84/2, II Floor, Panathur Main Road, Kadubeesanahalli Off Outer Ring Road, Bengaluru - 560103, Karnataka.
Tel: Phone Number: +91 80461 22800
E-mail: cs@blackbuck.com Website: www.blackbuck.com

NOTICE OF THE 10TH ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION

NOTICE is hereby given that Tenth (10th) Annual General Meeting ('AGM') of Zinka Logistics Solutions Limited (the 'Company') will be held on **Friday, September 12, 2025 at 11:30 AM (IST)**, through Video Conferencing ('VC') / Other Audio Visual Means ('OAVM') to transact the business as set out in the Notice convening the AGM. The proceedings of the AGM shall be deemed to be conducted at the Registered Office of the Company which shall be the deemed venue of the AGM.

In compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the rules made thereunder read with General Circular No. 09/2024 dated September 19, 2024 and any other circular issued in this regard by the Ministry of Corporate Affairs, read with SEBI/HO/CFD/CFDPoD-2/P/CIR/2024/133 dated October 3, 2024 and any other circulars issued in this regard by the issued by Securities and Exchange Board of India ('SEBI') and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (including any amendments, modifications or re-enactments thereof for the time being in force) ('SEBI Listing Regulations'), the Notice and Annual Report for the financial Year ended March 31, 2025 ('Annual Report') have been sent only to the Members of the Company whose email addresses are registered with the Company/RTA/Depository Participant(s). The electronic dispatch of Notice and Annual Report to the members have been completed on Wednesday, August, 13, 2025.

The Notice convening the AGM along with the Annual Report is also available on the Company's website at www.blackbuck.com, websites of the Stock Exchanges, i.e., BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com, respectively and website of the KFin Technologies Limited ('KFin'), Registrar and Transfer Agent ('RTA'), (agency for providing remote e-voting facility) at <https://evoting.kfintech.com>.

Additionally, a letter providing web-link to access the Annual Report and the Notice of AGM of the Company is being dispatched to those shareholders who have not registered their e-mail address with Company/RTA/depository(ies)/depository participant(s).

In compliance with Section 108 of the Act read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended from time to time and Regulation 44 of the Listing Regulations, Members holding shares in physical or dematerialized form, as on the cut-off date, i.e., **Friday, September 05, 2025**, may cast their votes electronically on the businesses as set forth in the Notice through the electronic voting system of KFin (the 'Remote e-voting'). A person who is not a shareholder as on the Cut-off date should treat this communication for information purpose only. The voting rights of the shareholders shall be in proportion to the paid-up share capital of the Company held by them as on the Cut-off date.

The person who acquires shares and becomes member of the Company after the dispatch of Notice and holds shares as on the Cut-off date, may follow the process as provided in the Notice for remote e-voting/e-voting at the AGM. Further, the members may also contact remote e-voting/e-voting during the AGM helpdesk at evoting@kfintech.com or call at 1800 309 4001.

All the members are informed that:

a) The business set out in the Notice may be transacted through remote e-voting or e-voting at the AGM;

b) The remote e-voting period is as follows:

Commencement of remote e-voting	Tuesday, 9 September, 2025 at 9:00 am (IST)
Conclusion of remote e-voting	Thursday, 11 September, 2025 at 5:00 pm (IST)

c) Remote e-voting shall not be allowed beyond Thursday, 11 September, 2025 at 5:00 pm (IST) and remote e-voting module shall be disabled by KFin upon expiry of aforesaid period.

d) Shareholders who have casted their vote(s) by remote e-voting prior to the AGM may also attend and participate in the AGM through VC/OAVM but shall not be entitled to cast their vote(s) again.

e) Facility for e-voting will also be available during the AGM and those members present in the AGM through VC/OAVM, who have not casted their vote on the resolution through remote e-voting and are not otherwise barred from doing so, shall be eligible to vote through the e-voting at the AGM in the manner as set out in the Notice.

f) Once the vote is casted by the members on a resolution, the member will not be allowed to modify or change his/her vote subsequently.

Members of the Company holding equity shares in physical/dematerialized form and who have not registered their email address can temporarily register their email address for the purpose of receiving Notice and Annual Report following the process as set forth in the Notice. In case of queries, shareholders may write to evoting@kfintech.com or call at 1800 309 4001.

Members who wish to permanently register/update their email addresses with the Company may follow below instructions:

Dematerialized Shares	Register/update the email addresses by following the process prescribed by the concerned DP.
Physical Shares	Register their email ID and other KYC details with the Company or RTA through ISR Forms only.


The detailed procedure for e-voting and joining the AGM through VC/OAVM, including the manner in which the members holding shares in physical/demat form and who have not registered their email address can cast their vote(s) through remote e-voting or e-voting at the AGM, is provided in the Notice.

1. In case of any queries, you may refer the Help & Frequently Asked Questions ('FAQs') available at the download section of <https://evoting.kfintech.com> or contact KFin at the email ID evoting@kfintech.com or call KFin's toll free No.: 1800 309 4001 for any further clarifications/ technical assistance that may be required or may reach out to Mr. Barun Pandey, Company Secretary & Compliance Officer by sending email at cs@blackbuck.com.

For Zinka Logistics Solutions Limited
Barun Pandey
Company Secretary and Compliance Officer
Membership No: A39508

Dated : 14.08.2025
Place : Bangalore


ATN INTERNATIONAL LIMITED				
CIN : L65993WB1983PLC080793				
Regd Office : 10, Princep Street, 2nd Floor, Kolkata - 700072				
Email : atninternationallimited@gmail.com, website : www.atninternational.in				
Phone No. 033-40022880, Fax : 91-33-22379053				
EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS				
FOR THE QUARTER ENDED 30TH JUNE, 2025				
(Rs. In Lacs)				
Sl. No.	Particulars	Quarter Ended 30.06.2025 (Unaudited)	Quarter Ended 31.03.2025 (Audited)	Quarter Ended 30.06.2024 (Unaudited)
1	Total Income from Operations	-	21.00	-
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items #)	(11.62)	7.39	(4.61)
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items #)	(11.62)	7.39	(4.61)
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items #)	(11.62)	7.39	(4.61)
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	-	-	-
6	Equity Share Capital	1578.00	1578.00	1578.00
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-
8	Earnings Per Share (of Rs.4/- each) (for continuing and discontinued operations)	(0.03)	0.02	(0.01)
	1. Basic :	(0.03)	0.02	(0.01)
	2. Diluted :	(0.03)	0.02	(0.01)
Note :a) The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the Stock Exchanges website i.e. www.nseindia.com, www.bseindia.com and www.cse-india.com and on the Company's website: www.atninternational.in.				
b) The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclosed by means of a footnote.				
c) # - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules /AS Rules, whichever is applicable.				
By order of the Board For ATN INTERNATIONAL LIMITED Sd/- Santosh Kumar Jain, Managing Director DIN No. 00174235				
Place : Kolkata Date : 12th August, 2025				

		Chhipwad Branch: House No - 8/1939, Opp. Govindji Temple, Chhipwad, Surat - 395 002 E-Mail: chhipw@bankofbaroda.com	
NOTICE TO BORROWER (UNDER SUB-SECTION (2) OF SECTION 13 OF THE SARFAESI ACT, 2002)			
To, Jodhani Maulik Kamleshbhai Flat No 1304, F/2 Building, Rushikesh, Opp Zeel Park, Vraj Bhumi Township, Nana Varachha, Surat-395013 Mrs. Kanuben Bhagwanbhai Talaviya Flat No 1304, F/2 Building, Rushikesh, Opp. Zeelpark, Nanavarachha, Vrajbhumi Township, Surat-395013			
Sub.: Notice under section 13(2) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, hereinafter called "The Act" A/c Mr. JODHANI MAULIK KAMLESHBHAI AND Mrs. KANUBEN BHAGWANBHAI TALAVIYA			
Dear Sir/Madam Re: Credit facilities with our Chhipwad Branch. We refer to our Sanction letter no. 00000038370 LMS dated 30.12.2018 for your Housing Loan advance account Mr. MAULIK KAMLESHBHAI JODHANI and Mrs. KANUBEN BHAGWANBHAI TALAVIYA conveying sanction of various credit facilities and the terms of sanction. Pursuant to the above sanction you have availed and started utilizing the credit facilities after providing security for the same, as hereinafter stated. The present outstanding in various loan/credit facility accounts and the security interests created for such liability are as under:			
Nature & type of Facility	Limit	Rates of Interest	O/s as on 30.07.2025 (Amount in Rs.) + Further Interest thereon + and Other Charges if any
Housing Loan 0750060002 0968	Rs.25,00,000/-	9.00 % i.e Net Interest Rate	Rs. 24,79,598.14 (Principal) + Rs. 19,439.69 (Unapplied interest +58,203.00 (Unserviced interest) + compound interest from 01.07.2025 to 30.07.2025 +penal interest @ 2% Simple)= Rs. 25,56,068.83/- + Further Interest thereon + and Other Charges if any
Baroda Personal Loan COVID 0750060002 1324	Rs.1.35,000/-	11.00% p.a	Rs. 25,681.78+ Rs. 258.89 Unapplied Interest + 608.00 Unserved interest + compound interest from 01.07.2025 to 30.07.2025 + and Other Charges thereon + and Other Charges if any, i.e = 25,56,781.83/- + Further Interest thereon + and Other Charges if any.
Total	Rs.26.35,000.00		25,82,637.54 + Further Interest thereon
		Security agreement with brief description of securities All that right title and interest in the property bearing Flat No. 1304 admeasuring about 752 sq. fts. i.e. 69.89 sq.mts. on 13 th floor of "F-2" building "RUSHIKESH" together with undivided proportionate land admeasuring about 34.42 sq.mts. underneath the said building constructed on the land bearing Revenue Survey No. 50. i.e. Block No. 81 of village NANA VARACHHA Taluka Pura District Surat and Final Plot No.43 of Town Planning Scheme No.38 (Nana Varachha) Boundary Description East: Margin/other Society West: Stair/passageway/fill North: Adj Flat No 1303 South: Internal Road / Parking In Name Of Mrmaulik Kamleshbhai Jodhani & Mrs. Kanuben Bhagwanbhai Talaviya.	

Description of Securities:
All That Piece And Parcel Of The Immovable Property Bearing Property Bearing Survey No Rs No 50, Block No 81, To No 38, Fp No 43, Flat No 1304 Nanavarachha, Surat, Located At Plot No, Flat No 1304, Door No/house, Nearest Door-, Adm. Land Sq Feet, Build Up Area 1185, Which Is Situated At Rs No 50, B No 81, To No 38 Fp No 43, Flat No 1304, F/2 Building, Rushikesh, Opp zeel Park, Nanavarachha, Surat, Vrajbhumi Township, Municipality, City Surat City. District Surat. Boundary Description East: Margin/other Society, West: Stair/passageway/lift, North: Adj Flat No 1301, south: Internat Road/parking in the name of Mr. MAULIK KAMLESHBHAI JODHANI & Mrs. KANUBEN BHAGWANBHAI TALAVIYA.

1. In the Document of Loan Agreement for Baroda Home Loan dated 31.12.2018, you have acknowledged your liability to the Bank to the tune of Rs. 25,00,000/- and Baroda Personal Loan COVID dated 07.12.2020 of Rs. 1,35,000/- respectively. The outstanding stated above include further drawings and interest upto 01.05.2025. Other charges debited to the account are Rs. Nil. 2. As you are aware, you have committed defaults in payment of interest on above loans/outstanding for the quarter ended 30.06.2025. You have also defaulted in payment of installments of term loan/demand loans which have fallen due for payment on 01.07.2025 and thereafter. 3. Consequent upon the defaults committed by you, your loan account has been classified as non-performing asset on 30.07.2025 (mention date of classification as NPA) in accordance with the Reserve Bank of India directives and guidelines. In spite of our repeated requests and demands you have not repaid the overdue loans including interest thereon. 4. Having regard to your inability to meet your liabilities in respect of the credit facilities duly secured by various securities mentioned in para 1 above, and classification of your account as a non-performing asset, we hereby give you notice under sub-section (2) of section 13 of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, and call upon you to pay in full and discharge your liabilities to the Bank aggregating Rs. 25,82,637.54 (Rupees Twenty Five Lacs Eighty Two Thousand Six Hundred Thirty Seven and Fifty Four paise Only.) / -- Interest & Other Charges thereon + and Other Charges if any, as stated in para 1 above, within 60 days from the date of this notice. We further give you notice that failing payment of the above amount with interest till the date of payment, we shall be free to exercise all or any of the rights under sub-section (4) of section 13 of the said Act, which please note. 5. Please note that, interest will continue to accrue at the rates specified in para 1 above for each credit facility until payment in full. 6. We invite your attention to sub-section 13 of the said Act in terms of which you are barred from transferring any of the secured assets referred to in para 1 above by way of sale, lease or otherwise (other than in the ordinary course of business), without obtaining our prior written consent. We may add that non-compliance with the above provision contained in section 13(13) of the said Act, is an offence punishable under section 29 of the Act. 7. We further invite your attention to sub-section (8) of section 13 of the said Act in terms of which you may redeem the secured assets, if the amount of dues together with all costs, charges and expenses incurred by the Bank is tendered by you, at any times before the date of publication of notice for public auction /inviting quotation / tender /private treaty. Please note that after publication of the notice as above, your right to redeem the secured assets will not be available. 8. Please note that this demand notice is without prejudice to and shall not be construed as waiver of any other rights or remedies which we may have, including without limitation, the right to make further demands in respect of sums owing to us.

Date : 02.08.2025 | Place : Surat Authorized Officer, Bank of Baroda, Chhipwad Branch



बैंक ऑफ़ बड़ौदा

Bank of Baroda

Regional Office, 1st Floor, Mahalaxmi Towers, Tithal Road.

Dist. Bulsar - 396 001, Gujarat, India., Ph.: 02632-241454,

Email: recovery.bulsar@bankofbaroda.co.in

Auction Sale Notice

For Gold Loan


NOTICE

The under mentioned persons are hereby informed that they have failed to pay off the liability in the loan accounts. Notices sent to them by Registered Post have been returned undelivered to the Bank. They are therefore requested to pay off the liability and other charges and redeem the pledged securities on or before 27.08.2025 failing which the said securities will be sold by the Bank in public auction at the cost of the borrower at the Bank's premises at 12:00 P.M. to 04:00 P.M. on 28.08.2025 or on any other convenient date thereafter without further notice at the absolute discretion of the Bank.

Sr. No	Branch Name	Date of Loan	Loan Number	Name and address of the borrower
1	BULSAR MAIN, GUJARAT 9687680713	31-05-2024	02330600008223	Patel Pratixaben Manishbhai, Devcha Faliya Chharvada, Untdi, Valsad Gujarat - 396030
2	BULSAR MAIN, GUJARAT 9687680713	31-01-2023	02330600006595	Mohamedsalim Gulamali Mulla, Dr K C Patel Nana Taiwad, Valsad - 396001
3	DHARAMPUR, VALSAD 7776827584	14-05-2024	13490600006766	Ahir Dharmishabhen Rakeshbhai, 1371 Ahir Street Kanurbarda, Harampur, Valsad 396050
4	MOTI DAMAN, DAMAN & DIU 8469380142	14-03-2024	33530600001211	Anand Kumar Rai, Sun Sine Society A 4 A 306 Kopari Road, Chhiri Vapi 396191
5	RAKHOLI, SILVASSA 8605406562	28-09-2022	36730600001657	Divyaben Prabhubhai Patel, 220 School Faliya Samarvani Silvassa DNH Dadra And Nagar Haveli - 396230
6	ABRAMA BULSAR, GUJARAT 9687680702	18-01-2025	33000600005397	Dhaval Dharmendra Dubey, 540 Manek Nagar Orwad, Udwada Rs Tal Pardi 396185

Date : 14.08.2025 Place : Valsad

BRANCH MANAGER




TRANS INDIA HOUSE IMPEX LTD

CIN: L74110GJ1987PLC152434
Reg. Off: B-1101, Titanium Square, B/h. Sarveshwar Tower, OPP. B. M. W. Show Room, Thaltej, Ahmedabad - 380 054, Gujarat, INDIA
E-mail: compliance@tihil.co.in, Website: www.tihil.co.in

EXTRACTS OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS OF THE COMPANY FOR THE QUARTER ENDED ON 30TH JUNE 2025


The Full format of the Unaudited Standalone Financial Results of the Company for the Quarter Ended on 30th June 2025 are available on the Stock Exchange(s) Website (www.bseindia.com) and on the Company's website (www.tihil.co.in).

The same can be accessed by scanning the QR Code provided Below.



On behalf of Board of Directors
For Trans India House Impex Limited
Mayank Suresh Jolly
Whole Time Director
DIN:0936175

Place : Ahmedabad
Date : 13.08.2025



Head Office: HDFC Bank Ltd., HDFC Bank House, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai-400013
Regional Office: HDFC Bank Ltd., Department For Special Operations, at 3 rd Floor, C-Wing, Sheetal West Park Imperia, Vastrapur Lake, Ahmedabad - 380054.

E-AUCTION SALE NOTICE

PUBLIC NOTICE FOR E-AUCTION FOR SALE OF IMMOVABLE PROPERTIES
E-Auction Sale Notice for Sale of immovable property mortgaged to Bank under Securitization and Reconstruction of Financial assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8(6) of the Security Interest (Enforcement) Rule, 2002.
Notice is hereby given to the public in general and in particular to the Borrower(s)/Mortgagor(s)/Guarantor(s) that, the Authorized Officer(s) of HDFC BANK LTD. (the Bank) had taken physical possession of the following property mentioned, pursuant to demand raised vide notice(s) issued under Sec 13(2) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 in the following loan accounts with right to sell the same on "AS IS WHERE IS, AS IS WHAT IS, WHATEVER IS THERE IS AND WITHOUT RECOURSE BASIS" for realization of Bank's dues plus interest as detailed hereunder and whereas consequent upon failure to repay the dues, the undersigned in exercise of power conferred under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules proposes to realize the Bank's dues by sale of the said property/ies. The sale of the below-mentioned Properties shall be conducted by way of E-Auction through Web Portal: <https://www.bankauctions.com>.

Names of the Branch & Account	Name of the Mortgagor & Guarantor's of the Property	Details of Collateral Property	Reserve Price EMD Bid Increase Amount	Inspection Date and Time	Date / Time of E-Auction
			Rs.1,10,00,000/- Rs. 11,00,000/- Rs. 1,00,00,00/-	30.08.2025 from 11.00 AM to 01.00 PM	19.09.2025 at 02.00 PM to 03.00 PM Last Date of Receipt of Bids alongwith EMD 13.09.2025 upto 4 PM
HDFC Bank Ltd. Branch: Odhav branch A/c No. 50200034442676	Mortgagor: Mr. Maheshbhai Langnecha, Guarantor: Mr. Nareshbhai Langnecha	Industrial plot No. 627/3, admeasuring area 600.00 Sq.Mtrs. Of Survey No 113/P and 114/P of village Palej, Taluka and district Bharuch owned by Mr. Maheshbhai Langnecha. North: 20.00 Mt. Road, South: 16.00 Mt. Road, East: Plot No. 627/4, West: Plot No. 627/2.			
Amount as per Demand Notice / Demand Notice Date Rs. 1,04,28,167.21/- Demand Notice Dated: 24.02.2020			Name of Authorised Officer / Phone No. / Email id: Anil Sankhla / 09512999191 / anil.sankhla@hdfcbank.com		

TERMS & CONDITIONS:

- The e-Auction is being held on "AS IS WHERE IS, AS IS WHAT IS, WHATEVER IS THERE IS AND WITHOUT RECOURSE BASIS"
- The interested bidders shall submit their EMD details and documents through Web Portal: <https://www.bankauctions.com> (the user ID & Password can be obtained free of cost by registering name with <https://www.bankauctions.com>) through Login ID & Password. The EMD shall be payable EITHER through NEFT / RTGS in the following Account: 5750000904261, Name of the Account: DFSO Transitory account, Name of the Beneficiary: HDFC BANK LTD., IFSC Code: HDFC0000240. Please note that the Cheques / Demand Drafts shall not be accepted as EMD amount.
- To the best of knowledge and information of the Authorized Officer, there is no encumbrance i.e. statutory dues like property taxes, society dues etc as per Bank's record on the property other than the one leasehold rights created which is mentioned in detailed terms and conditions. The Bank however shall not be responsible for any present/past/future outstanding non-statutory dues/statutory dues/encumbrances/tax arrears/litigations, if any. The intending bidders should make their own independent inquiries regarding the encumbrances, title of property & to inspect & satisfy themselves. **Property can be inspected strictly on the above mentioned date and time.**
- The intended bidders who have deposited the EMD and require assistance in creating Login ID & Password, uploading data, submitting bid, training on e-bidding process etc., may contact our service provider M/s. C1 India Pvt. Ltd., 3rd Floor, Plot No. 68, Sector 44, Gurgaon, Haryana-122003. **Support Mobile Nos. : 7291981124/1125/1126, Mr. Bhavik Pandya - 0886682937. E-mail ID: support@bankauctions.com/gujarat@c1india.com.** For any property related query may contact the **Authorized officer as mentioned above** in office hours during the working days. **(10:00 AM to 5:00 PM)**. Hard copy of Tender Form be submitted along with Bid and EMD strictly on the above-mentioned date and time at above address of Authorised Officer.
- If the Sale Price is more than **Rs. 50,00,000/-** (Rupees Fifty Lakh Only) then the auction purchaser/successful bidder has to deduct 1% of the Sale Price as TDS in the name of the owner of the property & remit it to Income Tax Department as per section 194 I of Income Tax Act and only 99% of the Sale Price has to be remitted to the Bank. The Sale Certificate will be issued only on receipt of Form 26D8 & Challan for having remitted the TDS.
- The highest bid shall be subject to approval of **HDFC Bank Limited**. Authorized Officer reserves the right to accept/ reject all or any of the offers/ bids so received, or cancel the auction/sale without assigning any reasons whatsoever. His decision shall be final & binding.
- (FOR DETAILED TERM AND CONDITIONS PLEASE REFER TO OUR WEBSITE www.hdfcbank.com and www.bankauctions.com)

STATUTORY 30 DAYS SALE NOTICE UNDER RULE 8(6) OF THE SARFAESI ACT, 2002

This may also be treated as notice u/r 8(6) read with Rule 9(1) of Security Interest (Enforcement) Rules, 2002 to borrowers / and Guarantors of the above said loan about the holding of E-Auction Sale on the above mentioned date. The borrower/ guarantors / mortgagors are hereby notified to pay the sum as mentioned above along with upto dated interest and ancillary expenses before 30 days of this notice / the date of Auction, failing which the property will be auctioned / sold and balance dues, if any, will be recovered with interest and cost.

Date : 14.08.2025, Place : Ahmedabad

Sd/- Authorized Officer, HDFC Bank Ltd.

SAYAJI SAYAJI INDUSTRIES LTD.

Regd. Office : P.O. Kathwada, Maize Products, Ahmedabad - 382430
Phone Nos. 079 22901581 to 85, E-mail : maize@sayajigroup.in
CIN:L99999GJ1941PLC000471

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON JUNE, 30 2025

The Board of Directors of the Company, at their Meeting held at August 14, 2025 approved the Unaudited Financial Results of the company, for the quarter ended June 30, 2025.


The results, along with the independent auditor's limited review report have been posted on the Company's Website at <https://sayajigroup.in/pages/investors> and can be accessed by scanning QR Code.

Note : The above intimation is accordance with Regulation 33 read with Regulation 47(1) of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015



For and behalf of Directors
Of Sayaji Industries Limited
Sd/-
Vishnu H. Thaker
Company Secretary
(ACS-60441)

Place : Ahmedabad
Date : 14.08.2025

		<div>PATANJALI®</div>					
		PATANJALI FOODS LIMITED					
		CIN: L15140MH1986PLC038536					
		Regd. Office: 616, Tulsiani Chambers, Nariman Point, Mumbai - 400021					
Statement of Standalone and Consolidated Unaudited Financial Results for the quarter ended 30 th June, 2025							
(Rs. in Lakhs)							
S. No.	Particulars	STANDALONE			CONSOLIDATED		
		Quarter Ended		Year Ended	Quarter Ended		Year Ended
		30.06.2025 (Unaudited)	30.06.2024 (Unaudited)	31.03.2025 (Audited)	30.06.2025 (Unaudited)	30.06.2024 (Unaudited)	31.03.2025 (Audited)
1	Total Income from Operations	8,89,970.53	7,17,716.79	34,15,696.73	8,89,970.53	7,17,716.79	34,15,696.73
2	Net Profit/(Loss) (before Tax, Exceptional and/or Extraordinary items)	24,859.75	35,915.47	1,72,616.43	24,856.51	35,897.81	1,72,552.91
3	Net Profit/(Loss) before tax (after Exceptional and/or Extraordinary items)	24,859.75	35,915.47	1,72,616.43	24,856.51	35,897.81	1,72,552.91
4	Net Profit/(Loss) after tax (after Exceptional and/or Extraordinary items)	18,039.14	26,290.15	1,30,134.16	18,035.90	26,272.49	1,30,070.64
5	Total Comprehensive Income [Comprising Profit/(Loss) (after tax) and Other Comprehensive Income (after tax)]	18,808.18	25,858.01	1,27,644.38	18,804.94	25,840.35	1,27,580.86
6	Equity Share Capital	7,248.60	7,238.37	7,242.02	7,248.60	7,238.37	7,242.02
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	11,29,910.39			11,29,846.87
8a.	Earnings Per Share (of Rs. 2/- each) (before extraordinary and exceptional items)*Not annualised						
	1. Basic :	4.98*	7.26*	35.96	4.98*	7.26*	35.94
	2. Diluted :	4.98*	7.26*	35.96	4.98*	7.26*	35.94
8b.	Earnings Per Share (of Rs. 2/- each) (after extraordinary and exceptional items) *Not annualised						
	1. Basic :	4.98*	7.26*	35.96	4.98*	7.26*	35.94
	2. Diluted :	4.98*	7.26*	35.96	4.98*	7.26*	35.94
Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the website of the Company- www.patanjalifoods.com and on the Stock Exchange websites www.bseindia.com and www.nseindia.com .							
		<div></div>					
Place : Haridwar Date: August 14, 2025		For AND ON BEHALF OF THE BOARD OF DIRECTORS Managing Director					



HINDUSTAN OIL EXPLORATION COMPANY LIMITED

Registered Office: 'HOEC House', Tandajia Road, Off Old Padra Road, Vadodara-390 020.
Website: www.hoec.com Email: hoecshare@hoec.com CIN: L11100GJ1996PLC029880

Extract of Standalone and Consolidated Financial Results (Unaudited) for the Quarter ended June 30, 2025

(₹ in Lacs except per share data)

S. No.	Particulars	Standalone		Consolidated			
		For the Quarter ended		For the Quarter ended		For the Quarter ended	
		30 June 2025	31 March 2025	30 June 2024	March 31 2025	30 June 2025	31 March 2025
		Unaudited	Unaudited	Unaudited	Audited	Unaudited	Audited
1	Total Income from Operations	8,197.54	17,901.90	8,371.91	38,498.00	8,150.66	10,047.20
2	Net Profit for the period (before tax and exceptional items)	1,569.26	13,100.85	1,262.64	14,847.33	1,222.10	3,557.68
3	Net Profit for the period before tax (after exceptional items)	4,821.13	13,100.85	1,262.64	14,847.33	4,473.97	3,557.68
4	Net Profit for the period after tax (after Exceptional items)	4,821.13	13,000.81	1,218.28	14,747.29	4,387.35	5,115.93
5	Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	4,811.61	12,988.97	1,209.86	14,709.19	4,377.83	5,104.83
6	Equity Share Capital	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93	13,225.93
7	Reserves				1,02,712.67		
8	Earnings Per Share (Face value of ₹ 10/-each) (not annualized)						
	Basic EPS ₹	₹ 3.65	₹ 9.83	₹ 0.9			

